

### કલમ-૪(૧)(બી) (૧):- સંસ્થાના કાર્યો અને ફરજોની વિગતો:-

હિસાબી ખાતાનું વ્યવસ્થાતંત્ર અને ફરજોની વિગતો

૧. ધી. બી. પી. એમ. સી. એકટ ૧૯૪૮ની કલમ ૮૨ થી ૮૨ મુજબ મ્યુ. ફંડની રચના, સ્પે. ફંડ, વધારાના ફંડનો ઉપયોગ, સ્વીકારકું, ઉપયોગની કામગીરી.
૨. ધી. બી. પી. એમ. સી. એકટ ૧૯૪૮ની કલમ ૮૩ મુજબ સ્થાયી સમિતિ વખતોવખત નિર્દેશ/ એપ્રુવ કરેલા ફોર્મ્સ/નિયમો મુજબ હિસાબોની મેળવણી/જાળવણી કરવી.
૩. ધી. બી. પી. એમ. સી. એકટ ૧૯૪૮ની કલમ ૮૫ થી ૧૦૪ મુજબ વાર્ષિક અંદાજપત્ર, પુરવણી અંદાજપત્ર, કર અને દર સક્ષમ સત્તા ધ્વારા મંજૂર કરાવવાની કામગીરી.
૪. ધી. બી. પી. એમ. સી. એકટ ૧૯૪૮ ની કલમ ૧૦૮ થી ૧૨૫ માં સુચવ્યા મુજબ નાણાં ઉધીના લેવાના કાર્યો.
૫. ધી. બી. પી. એમ. સી. એકટ ૧૯૪૮ ની કલમ ૧૨૬ મુજબ સુરત મહાનગરપાલિકાએ કરેલ જાહેર દેવાની માહિતી નિયત કરેલ નમૂના મુજબના કાર્યો. સદર અધિનિયમ હેઠળ ફરજો અને સુરત મહાનગરપાલિકાના હિસાબોની મેળવણી.
૬. મ્યુ. કમિશનરશ્રીના હુકમોને આધિન મુખ્ય હિસાબનીશ/નાયબ હિસાબનીશ/સેક્રશન ઓફિસર/ પ્રથમ શ્રેણી કલાર્ક/બીજી શ્રેણી કલાર્ક/પટાવણા/બેલદારો વિગેરેની કાર્યવાહી પર દેખરેખ અને નિયંત્રણ રાખવાની અને વિનીમયનો આધીન સદરહુ કર્મચારીઓની નોકરી/મહેનતતાણું અને તેમના અધિકારોને લગતાં સઘળા પ્રશ્નોના નિવારણ કરવાનું કામ.
૭. સ્થાયી સમિતિ/મ્યુ. કમિશનરશ્રી સૂચવે તે મુજબ ફરજો બજાવવી.